



AXIS BANK LTD.

Regd. Office: 'Trishul', 3rd floor, Opp. Samartheshwar Temple, Near Law Garden, Ellisbridge, Ahmedabad - 380 006. Corporate Office: 'Axis House' C-2, Wadia International Centre, Pandurang Budhkar Marg, Worli, Mumbai - 400 025. CIN: L65110GJ1993PLC020769, Phone: 079-26409322, Fax: 079-26409321, Email: shareholders@axisbank.com

AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2021

(₹ in lacs)

	A	xis Bank (Standalone	∍)	Axis Bank (Consolidated)			
PARTICULARS	FOR THE QUARTER ENDED 31.03.2021	FOR THE YEAR ENDED 31.03.2021	FOR THE QUARTER ENDED 31.03.2020	FOR THE YEAR ENDED 31.03.2020	FOR THE QUARTER ENDED 31.03.2021	FOR THE YEAR ENDED 31.03.2021	FOR THE QUARTER ENDED 31.03.2020	FOR THE YEAR ENDED 31.03.2020
Total income from operations	20,213,46	78,483,49	20,219,57	78,171,72	21,028,45	80,847,94	20,786,23	80,057,67
Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	3,569,67	8,805,84	(1,878,91)	4,904,23	3,957,20	9,750,08	(1,757,58)	5,280,04
Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	3,569,67	8,805,84	(1,878,91)	4,904,23	3,957,20	9,750,08	(1,757,58)	5,280,04
Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	2,677,06	6,588,50	(1,387,78)	1,627,22	2,960,40	7,195,50	(1,262,43)	1,853,11
Paid-up equity share capital (Face value ₹2/- per share)	612,75	612,75	564,34	564,34	612,75	612,75	564,34	564,34
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	100,990,26 (As on 31st March, 2021)	100,990,26 (As on 31st March, 2021)	84,383,51 (As on 31st March, 2020)	84,383,51 (As on 31st March, 2020)	1,02,980,95 (As on 31st March, 2021)	1,02,980,95 (As on 31st March, 2021)	85,776,09 (As on 31st March, 2020)	85,776,09 (As on 31st March, 2020)
Earnings per Share (Face value ₹2/- per share) (for continuing and discontinued operations) (₹) (not annualised)								
- Basic - Diluted	8.74 8.72	22.15 22.09	(4.92) (4.92)	5.99 5.97	9.60 9.58	24.19 24.13	(4.48) (4.48)	6.83 6.80

- 1. Information relating to Total Comprehensive Income and Other Comprehensive Income is not furnished as Ind AS is not yet made applicable to banks.
- 2. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the website of the Bank (www.axisbank.com) and on the Stock Exchange websites (www.nseindia.com and www.bseindia.com).

For and on behalf of the Board

Place: Mumbai Date: 27th April, 2021

www.axisbank.com

AMITABH CHAUDHRY

SHRIRAM MUTUAL FUND Mookambika Complex 3rd Floor, 4 Lady Desikachari Road, Mylapore, Chennai - 600,004 (Investment Manager: Shriram Asset Management Company Limited) CIN: L65991MH1994PLC079874

Registered Office: 1006, 10th Floor, Meadows, Sahar Plaza, Andheri Kurla Road, J.B. Nagar, Andheri (East), Mumbai - 400 059.

NOTICE

Half-Yearly Unaudited Financial Results of Schemes of Shriram Mutual Fund

NOTICE is hereby given that the unaudited financial results of the Schemes of Shriram Mutual Fund for the half-year ended March 31, 2021 have been hosted on the website of Shriram Asset Management Company Limited (www.shriramamc.in), in accordance with Regulation 59 of SEBI (Mutual Funds) Regulations, 1996. Investors may accordingly view / download the results from the website.

> For Shriram Asset Management Company Limited (Investment Manager of Shriram Mutual Fund)

Date : April 27, 2021

Compliance Officer

Place: Kolkata For more information, please contact **Shriram Asset Management Co. Ltd.**, CK-6, 2nd Floor, Sector II, Salt Lake City, Kolkata - 700 091. Tel.: 033 2337 3012, Email: info@shriramamc.in, Fax: 033 2337 3014, www.shriramamc.in

> Mutual fund investments are subject to market risks, read all scheme related documents carefully.





HINDUSTAN ZINC LIMITED

Regd Office: Yashad Bhawan, UDAIPUR-313 004 PBX No. 0294-6604000, CIN-L27204RJ1966PLC001208, www.hzlindia.com

STATEMENT OF AUDITED FINANCIAL	RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2021
	(₹ in Crore, except as st

				(₹ in Crore, exc	ept as stated
			Quarter ended		Year e	nded
	Particulars	31.03.2021	31.12.2020	31.03.2020	31.03.2021	31.03.2020
	. artisalars	Audited	Unaudited	Audited	Audited	Audited
		(Refer note 3)				
1	Total income from operations	7,242	6,483	4,861	24,448	20,495
2	Net Profit for the period (before tax)	3,343	2,945	1,865	10,574	8,390
3	Net Profit for the period (after tax)	2,481	2,200	1,339	7,980	6,805
4	Total Comprehensive Income for the period [comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	2,475	2,198	1,294	7,975	6,705
5	Equity Share Capital	845	845	845	845	845
6	Reserves as shown in the Audited Balance Sheet				31,468	39,465
7	Earnings Per Share in Rs (of ₹ 2 each) for continuing and discontinued operations					
8	Basic : Diluted:	5.87 5.87	5.21 5.21	3.17 3.17	18.89 18.89	16.11 16.11
9 10	Debt Service Coverage Ratio (No. of times) Interest Service Coverage Ratio (No. of times)				30 30	79 79

- 1) The above is an extract of the detailed format of quarterly Financial Results reviewed by Audit Committee and approved by the Board of Directors on April 27, 2021 and filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly Financial Results and additional disclosures as per Regulation 52(4) of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosures Requirement) Regulations, 2015 are available on the Exchange websites www.nseindia.com & www.bseindia.com and on the Company's website www.hzlindia.com.
- 2) Figures for previous year and quarter have been revised or reclassifed, wherever necessary, for consistency.
- 3) The figures of the quarter ended March 31, 2021 are the balancing figures between audited figures for the full financial year ended March 31, 2021 and nine months unaudited published figures up to December 31, 2020.

By Order of the Board

Date: April 27, 2021 Place: Udaipur

Arun Misra **CEO & Whole-time Director**





Assets

- 5 operational projects 11 transmission lines with a network of ~3,698.59 ckm, and 3 sub-stations with 6,630 MVA of aggregate transformation capacity*
- Sound operational track record with high availability

Assurance

- Backing of world's 3rd largest transmission utility[#] as Sponsor and Project Manager
- TBCB assets on build-own-operate-maintain basis with 35 years' contract period

Advantage

- Availability-based tariff High visibility on cash flows
- Large pool of sponsor's assets and debt-funded acquisition strategy



As of December 31, 2020. *(Source: www.worldbank.org/en/country/india/overview#3) as of October 25, 2019 according to the World Bank.

POWERGRID Infrastructure Investment Trust acting through its Investment Manager is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offer of its units representing an undivided beneficial interest in the Trust ("Units"), and has filed the Offer Document with the SEBI, and the Stock Exchanges. The Offer Document is available on the website of SEBI at www.sebi.gov.in, the BSE at www.bseindia.com, the NSE at www.bseindia.com and on the websites of the Lead Managers at www.icicisecurities.com, www.axiscapital.co.in, www.edelweissfin.com and https://www.business.hsbc.co.in/en-gb/in/generic/ipo-open-offer-and-buyback. Investors should note that investment in the Units in the Units and the section "Forward-Looking Statements" on page 16 of the Offer Document.

These materials are not for publication or distribution, directly or indirectly, in or into the United States. The United States and, unless so registered under the U.S. Securities Act of 1933, as amended (the "Securities Act of 1933, as amended (the "Securities Act") or any other applicable state securities laws of the United States and, unless so registered, may not be offered or sold within the United States except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the Securities Act and applicable state securities laws. Accordingly, the United States only to persons reasonably believed to be "qualified institutional buyers" (as defined in Rule 144A under the Securities Act ("Rule 144A") and referred to in the Offer Document as "U.S. QIBs". For the avoidance of doubt, the term U.S. QIBs does not refer to a category of institutional investor defined under applicable Indian regulations and referred to in the Offer Document as "QIBs") in transactions exempt from the registration requirements of the Securities Act; and (b) outside the United States in compliance with Regulation S under the Securities Act ("Rule 144A") and referred to in the



HDFC Bank to upgrade its credit card business

The key agenda is to make the processes more efficient and cost-effective

DFC Bank Ltd, India's biggest private sector lender, is look-ing to replace its legacy credit card system with a modern technology platform to make s more efficient and cost-effective, according to a person aware of the matter. The decision to upgrade the system of credit cards is also expected to give customers a better experience and more secu-rity, the person said on condition of ano-

rity, the person said on condition of ano-ymity.

RBI hadstopped the private sector bank from issuing new cards in December with-out specifying a reason.

"HDPC Bank is considering moving its card platform to a credible finitech com-pany for better end-to-end processing of cards, customer experience, and security. Thereare many newage finites that have developed a good platform for online bank-ing, credit card liss junce and management developed agood platform for online bank-ing, credit card issuance and management that are offering banks the option to migrate it to their platforms," said the per-son aware of the matter. "The bank is in talks with fintech companies such as Zeta and Sprink! For launching their credit cards once the ban is lifted," the person added.

In its reponse to a query, an IIDPC Bank spokesperson said the point about moving and transferring the portfolio is incorrect.



HDFC Bank started the conversation

HDFC Bank started the conversation with fintech companies nearly two years ago. But the need to move the result and open was felt following the surger of the start of the surger of the

banking businessat Zeta, the company recommends that banks first transfer their reedit card platform onto their digital platform before moving their entire product portfolio to the cloud. "We would tetlihem that you haunch a modern credit card sperience for the nullennial customer in the first instances of gives them the ability to test oursystems for eadability and get comfortable with the way our system would extensive the story systems of the company and the company and

AXIS BANK LTD.

Regd. Office: 'Trishul', 3rd floor, Opp. Samartheshwar Temple, Near Law Garden, Ellisbridge, Ahmedabad - 380 006. Corporate Office: 'Axis House' C-2, Wadia International Centre, Pandurang Budhkar Marg, Worli, Mumbai - 400 025 CIN: L65110GJ1993PLC020769, Phone: 079-26409322, Fax: 079-26409321, Email: shareholde

AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2021

	Δ	xis Bank (Standalone	=)	A	kis Bank (C	Consolidate	ed)
PARTICULARS	FOR THE QUARTER ENDED 31.03.2021	FOR THE YEAR ENDED 31.03.2021	FOR THE QUARTER ENDED 31.03.2020	FOR THE YEAR ENDED 31.03.2020	FOR THE QUARTER ENDED 31.03.2021	FOR THE YEAR ENDED 31.03.2021	FOR THE QUARTER ENDED 31.03.2020	FOR THE YEAR ENDED 31.03.2020
Total income from operations	20,213,46	78,483,49	20,219,57	78,171,72	21,028,45	80,847,94	20,786,23	80,057,67
Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	3,569,67	8,805,84	(1,878,91)	4,904,23	3,957,20	9,750,08	(1,757,58)	5,280,04
Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	3,569,67	8,805,84	(1,878,91)	4,904,23	3,957,20	9,750,08	(1,757,58)	5,290,04
Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	2,677,08	6,588,50	(1,387,78)	1,627,22	2,960,40	7,196,50	(1,262,43)	1,853,11
Paid-up equity share capital (Face value ₹2/- per share)	612,75	612,75	564,34	564,34	612,75	612,75	564,34	564,34
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	100,990,26 (As on 31 st March, 2021)	100,990,26 (As on 31" March, 2021)	84,383,51 (As on 31" March, 2020)	84,383,51 (As on 31 st March, 2020)	1,02,980,95 (As on 31 st March, 2021)	1,02,980,95 (As on 31 st March, 2021)	85,776,09 (As on 31 st March, 2020)	85,776,09 (As on 31 st March, 2020)
Earnings per Share (Face value ₹2/- per share) (for continuing and discontinued operations) (₹) (not annualised)								
- Basic - Diluted	8.74 8.72	22.15 22.09	(4.92) (4.92)	5.99 5.97	9.60 9.58	24.19 24.13	(4.48) (4.48)	6.83 6.80

- is not yet made applicable to banks.
- 2. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the website of the Bank (www.axisbank.com) and on the Stock Exchange websites (www.nseindia.com and www.bseindia.com).

Place: Mumbai Date: 27th April, 2021

AMITABH CHAUDHRY MD & CEO

Non-banks seek debt recast for small peers

on-bank financiers have urged the Reserve Bank of India to allow small lenders with assets of less than ₹500 crore to get their loans restructured, which will

loans restructured, which will help them overcome any possi-ble asset-liability mismatch. "The only mode of Dorrow-ings for the small non-banking financial companies (NPECs) is to raise term loans from banks, financial institutions... and large NPECs. They do not access capital markets and nei-ther do they issue bonds or debentures," Finance Industry

ders said in a letter to RBI governors baidblanta base on Thes-day.

NBFCs have been stringgling with a liquidity crunchever since the defaults at first return classing and Financial Services (ILAFS) in September 2018.

September 2018.

Development of the deb recess scheme. FIDC urged RBI to extend the scheme not just for small NBFCs, but its borrowers too fill Sort of small NBFCs will be borrowers too fill Sort of small NBFCs and INSPCs and INSPCs and INSPC scheme not just for small NBFCs and INSPC scheme not just for s

Development Council(FIDC), a body representing non-lenders said in a letter to RB Igovernor Shakilkanta Das on Tuese

ristractured on any earlier occasion and standard as on 31 March 2021, may be allowed restructuring without any downgrade in asset classification, subject however to the lending NBFCs undertaking fresh credit assessment of the borrowing entity, "it added. The letter said that the second wave has begun impacting the industry, sepecially the self-employed segment. With many states, such as Maharashtra, Chihattisgarih, Madhya Pradesh, Kuranska, Dipasthamad Tamiil Nadu, under loekdown or loekdown like cuths, resulting in closure of branches, it is difficult to reach existences for collections, it said in the letter.

Remdesivir shortfall likely to ease soon

FROM PAGE 1

sterility (purity) clearance was

sterility fjurity clearance was longer," the executive said.
"But the government has now brought that down. I think the supplies should start improving from next week, and shortages will reduce if the cases don't go up further." Remdesivir is manufactured by seven companies in India—Hetero Drugs, Zydus Cadila, Dr. Reddy's Laboratories, Cipla, Jubilant Pharma, Mylan and Syngene International—

and Syngene Internationalunder a pact with the drug's US-based innovator Gilead

US-based innovator Glead Sciences Inc.

To be sure, the World Health Organization (WHO) in November recommended against the use of rendesivir in hospitalized covid-19 patients, but a number of countries con-tinue to administer it.

All seven Indian companies have scaled up manufacturing.
The government Commission active pharmaceutical ingredients to rapidly scale up production of remdesivir.

Earlier this The government wants companies to scale up their capacity to over 9 million vials per month from nearly 4 million earlier this month. Since 12 April, it has cleared 25 new manufactions silling the silling s

cleared 25 new
manufacturingsites.
"As per the government
directive, the company has
alreadyramped up manufacturing capacity and is expected to

Gilead Sciences has said it will donate at least 450.000 doses of the drug to India to help fight the second wave

up production of rendesivir.
Earlier this
ciences of it will addsaked prices by 25-70% on the doses of it will a doses of it will a dose of it will be a dos

ead Sciences has said it will

donate at least 450,000 doses of the drug to India to help fight

of the drop of the drop of the second wave of covid-19.

The US firm will also provide its voluntary licence holders technical assistance, support for the addition of new local manufacturing facilities and donation of active pharmaceuring linearing the control of the drop of the dr

hospitals to turn away critically ill patients in some parts. Demand for remdesivir, used aiready rampectip manulacutring capacity and its expected to start increased supplies across the country from the middle of next week," a spokesperson for Hetero Drugssaid.

Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for Helping matters further, Gilteron air work of the spokesperson for the spokespe MARUTI SUZUKI INDIA LIMITED

Registered Office: Plot No.1, Nelson Mandela Road, Vasant Kuni, New Delhi - 110070

CIN: L34103DL1981PLC011375; Website: www.marutisuzuki.com; E-mail: investor@maruti.co.in; Phone: + 91-11-46781000; Fax: +91-11-46150275/76

Extract of Standalone Unaudited / Audited Financial Results for the quarter and year ended March 31, 2021

INR in million, except per share data

MARUTI 🎉 💲 SUZUKI

			Quarter ended		Year	ended
Sr. No	Particulars	31 st March, 2021	31 st December, 2020	31" March, 2020	31" March, 2021	31 st March, 2020
		Unaudited	Unaudited	Unaudited	Audited	Audited
-1	Total Income from Operations	240,237	234,578	181,987	703,325	756,106
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items)	13,075	24,498	15,755	51,594	70,648
3	Net Profit / (Loss) for the period (before Tax, after Exceptional and / or Extraordinary Items)	13,075	24,498	15,755	51,594	70,648
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary Items)	11,661	19,414	12,917	42,297	56,506
5	Total Comprehensive Income /(Loss) for the period (comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income /(Loss) (after tax)]	12,603	21,468	10,732	47,423	52,089
6	Equity Share Capital	1,510	1,510	1,510	1,510	1,510
7	Reserve as shown in the Audited Balance Sheet				512,158	482,860
8	Earnings Per Share (of INR 5 each) (for continuing and discontinued operations)					
	(a) Basic	38.60	64.27	42.76	140.02	187.06
	(N) Diluted	38.60	64 27	42.76	140.02	187.06

Extract of Consolidated Unaudited / Audited Financial Results for the quarter and year ended 31st March, 2021

Extract or	Consciluated Unaddited / Addited Financial Results for the quarter and year ended 31st March, 2021						
					INR in million, exe	ept per share data	
			Quarter ended		Year ended		
Sr. No	Particulars	31" March, 2021	31" December, 2020	31™ March, 2020	31" March, 2021	31" March, 2020	
		Unaudited	Unaudited	Unaudited	Audited	Audited	
- 1	Total Income from Operations	240,345	234,713	182,077	703,720	756,600	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items)	13,836	25,103	16,186	53,210	71,028	
3	Net Profit / (Loss) for the period (before Tax, after Exceptional and / or Extraordinary Items)	13,836	25,103	16,186	53,210	71,028	
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary Items)	12,411	19,967	13,223	43,891	56,776	
5	Total Comprehensive Income /(Loss) for the period (comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income / (Loss) (after tax)]	13,360	22,023	11,038	49,027	52,359	
6	Equity Share Capital	1,510	1,510	1,510	1,510	1,510	
7	Reserve as shown in the Audited Balance Sheet				523,496	492,812	
8	Earnings Per Share (of INR 5 each) (for continuing and discontinued operations)						
	(a) Basic	41.09	66.10	43.77	145.30	187.95	
	(b) Diluted	41.09	66.10	43.77	145.30	187.95	

Vote: The above is an extract of the detailed format of the Standalone and Consolidated Financial Results for the quarter and year ended March 31, 2021 filed with the Stock Exchanges under Regulations 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidade Financial Results for the quarter and year ended March 31, 2021 rear available on the websites of SES and NSE at www.bendia.com and www.nseinda.com and own of Company's website at www.rawildade Financial Results for the Consolidade Standalone and Consol

(Takahiko Hashimoto) Director (Marketing and Sales)

Place: Gurugram

૪૦ યુએસ

(પહેલા પાનાનું ચાલુ) રહી છે. યુએસના પ્રમુખ જો બાઇડને એસ્ટ્રાઝેનેકાના ૬૦મિલિયન ડોઝજેદેશો

કોરોનાની રસી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેમને ફાળવવાની જાહેરાત કરી છે.જો કે આ રસીના ડોઝ ધીમે ધીમે તૈયાર થશે તેમ ફાળવવામાં આવશે તેમ વ્હાઇટ થશે તેમ ફળવવામાં આવશે તેમ વ્હાઈટ હાઉસના પ્રેસ સેકેટરી જેન સાકીએ જણાવ્યું હતું. હાલ ૫૦ મિલિયન ડોઝ ઉન્માદનના ચિવિય તબક્કે છે જે મે અને જુનમાં તૈયાર થઇ જશે. બીજી તરફ તુકીમાં લોકોને વાતચીત કરીને કોરોનાની રસી વિવા માટે સમજાવવાના પ્રયાસોને ભારે સ્કળતા મળી છે. કૂડીશ શહેર અદિયામાનમાં કેશ્રુઆરીથી વૃઢોને કોરોનાની રસી લેવા માટે સમજાવવામાં આવતાં હતા પણ હવે

દિલ્હીની વાત

(પહેલા પાનાનં ચાલ)

સોશિયલ મીડિયા પર છવાયેલો છે. સોશિયલ મીડિયા પર મોદીની ટીકા કરતાં અખબારોના સ્ક્રીન શોટ વાયરલ થઈ રહ્યા છે. લોકો કોમેન્ટ્ર કરી રહ્યા છે કે, વિદેશી મીડિયામાં મોદીની જરાક વાહવાહી થાય તેમાં તો તેમને વૈશ્વિક નેતા ગણાવીને તૃટી પડતા સમર્થકો અત્યારે કેમ ચૂપ છે? મોદીની વાહવાહી કરનારા ભોજપના નેતા પણ આ અહેવાલો અંગે સાવ ચપ લોકો એવી કોમેન્ટ્સ પણ કરી રહ્યા કે, વૈશ્વિક મીડિયા મોદીને આયનો બતાવી રહ્યું છે તેના કારણે ભાજપની બોલતી બંધ થઈ ગઈ છે.

નાવતા ઝવ વઇ ગઇ છે. ટ્વિટર પર મંગળવારે 'રીઝાઈન-પીએમ-મોદી' હેશ્ટેગ પહેલા નંબરે યાએ મન્યાદા હસે દળ પહેલા પાગર ટ્રેન્ડ કરતું હતું. લોકો જાત જાતના ફની મીમ્સની સાથે વૈશ્વિક રીપોર્ટ્સ પછ મૂકીને મોદી સામે આક્રોશ દર્શાવતા

સીનિયર પ્રધાનો વતી ગડકરીએ અસંતોષ બતાવ્યો

મોદી સરકાર દેશમાં ઓક્સિજનની તંગી નહી હોવાની રેકર્ડ વગાડ્યા કરે છે ત્યારે નીતિન ગડકરીએ વગાડ્યા કરે છે ત્યારે નીતિન ગડાકીએ સ્ત્રીકાર્યું કે, બ્રીક્સજનની અદ્ભત છે અને પેટું સંક્રટ છે. ગડકરીએ તો કોરોના સામે લડાવા માટે પુરતી સગવડો નથી, વચાની અછત છે, હોક્ટરોની કમી છે, સ્વાફની તંગી છે એ પણ સ્ત્રીકાર્યું કન્યારે પ્રતિજ્ઞુ સંજોળો છે પણ પીરે પીરે બધું સરખું થઈ જશે એવાં આશાવાદ પણ ગડકરીએ વ્યક્ત કર્યાં, મોદી સરકાર, કોરોના મુદ્દે બચાવની સ્થિતીમાં છે ત્યારે જ ગડકરીએ સરકારની પોલ ત્યારે જ ગડકરીએ સરકારની પોલ ખોલતું નિવેદન કર્યું એ અત્યંત સૂચક છે. ભાજપનાં સૂત્રોના મતે, ગડકરીના માધ્યમથી મોદી સુરકારના સીનિયર પ્રધાનોએ નાગજગી વ્યક્ત કરી છે મોદીએ પોતે કોરોનાને કાબૂમાં લઈ લીધો હોવાનો જશ લેવાના મોહમાં સીનિયર પ્રધાનોની અવગણના કરી છે.

તેમને વાતચીત કરીને સમજાવાતા રસી લેવાનો દર ત્રીસ ટકાવધ્યો છે

દરમ્યાન આજે કોરોનાના દુનિયામાં નવા ૩,૦૯,૧૩૨ કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૧૪,૮૭,૯૭,૪૮૩ થઇ છે. આજે ૪,૦૭૮ જુણાના કોરોનાના કારક્ષે મોત થતાં ફુલ કોરોના મરણાંક ૩૧,૩૮,૨૦૦ થયો છે. ભારતમાં કોરોનાનો કુલ મરણાંક બે લાખ થવાને આરે છે

કોઈપણ દેશમાં (પહેલા પાનાનું ચાલુ) (પહેલા પાનાનું ચાલુ) સુપ્રીમકોર્ટમાં ૨૦૦ પાનાનું સોગંદનામુ રજૂ કરી કોરોના સામે લડવા માટે નેશનલ પ્લાન અંગે માહિતી આપી હતી. તેમાં મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર્

તરફથી જરૂરી સપ્લાય અને સેવાઓ મોદી સરકાર કોરોનાની સ્થિતીને કાબૂમાં લેવામાં નિષ્ફળ સાબિત થઈ છે છતાં સીનિયર પ્રધાનોને કોઈ મહત્વની કામીરી જ સોંપાતી નથી. મોદી હજુય અધિકારીઓના ઈશારે ચાલે છે અને અધિકારીઓના કારણે

રેશ ચાલતો હોય એ રીતે વર્તે છે તેના કારણે તેમનામાં અસંતોષ છે. વિજય સરઘસ નહીં. બંગાળમા ભાજપ નથી જીતવાનો ?

મદ્રાસ હાઈકોર્ટે ખખડાવ્યા પછી ચૂંટહી પંચે આબરૂ બચાવવા રવિવારે થનારી મતગજ્ઞતરીમાં વિજેતા ઉમેદવારોનાં વિજય સરઘસ સહિતની તમામ ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો. વિજેતા જીતનું સર્ટિફિકેટ મેળવવા જાય ત્યારે તેની સાથે બે જ સમર્થક જઈ શકશે.

તત્તવક જઇ શકશ. ચૂંટલી પંચે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવું કર્યું છે પણ તેનાથી થોડી રાહત મળશે એવું આરોગ્ય નિખ્હાતો સ્વીકારે છે. આરોગ્ય નિષ્ણાતા સ્વાકાર છ. રિવારે પાંચ રાજ્યોની ૮૧૪ વિધાનસભા બેઠકો ઉપરાંત જુદાં જુદાં રાજ્યોની ૧૩ વિધાનસભા અને લોકસભાની ૪ બેઠકોની પણ પેટાચૂંટણીનાં પરિણામ જીહેર થશે. દરેક બેઠક પર એક જ જગાએ ઉજવણી યાય એવું માનીએ તો પણ એકસાથે ૮૦૦થી વધુ સ્થળે કોરોના વિસ્ફોટ સર્જી શકે તેથી આ પગલું યોગ્ય છે. પંચના નિર્ણય પછી એવી જોક પણ

ચાલી રહી છે કે, બંગાળમાં ભાજપની હાર નક્કી લાગે છે. એ સિવાય ચૂંટલી પંચ વિજય સરઘસ પર પ્રતિબંધ ના મકે. મમતા બેનરજી વિજયોત્સવ ના મુકે. મમતા બેનરજી વિજયોત્સવ ના મનાવી શકે એટલે મોદી સરકારે ચૂંટણી પંચના માધ્યમથી વિજય ઉજવણી રોકાવી દીધી.

કેપ્ટન સામે હવે પ્રદેશ પ્રમખે મોરચો ખોલ્યો

પ્રસુખ મારવા ખાલ્લા પંજાબમાં કોટકપુરા ફાયરિંગ કેસમાં અકાલી દળના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલને ક્લીન ચીટ આપવાના હાઈકોર્ટના ચુકાદાના કારણે કેપ્ટન

Tenders are invited for Rate contract for S.I.T.C. Work of (1) 40/80, 150/150 litre/hr cooling capacity and litre stor-age capacity Type Water Cooler and (2) 60 Ltr./hr., 180/200 Litre/Hr. capacity Type Water Purifier with Water Level Sensor with Buy-Back Scheme at Eastzone Various Premises of

Tender details available on <u>www.nprocure.com/</u> https://amc.nprocure.com

Online Submission up to Dt. 19.05.2021 only up to 6.00 p.m.
Last date of Submission of Dt. 20.05.2021 only up to 4.00 p.m.

AHMEDABAD MUNICIPAL CORPORATION

ELECTRICAL DEPARTMENT E-TENDER NOTICE

અંગે બનાવાયેલી યોજનાઓ અંગે પણ માહિતી અપાી હતી. જોકે, તેમાં દૈનિક માહિતી અપી હતી. જોઠે, તેમાં દૈનિક કોરોના મેનેજમેન્ટ અંગે કશું જહાવાયું કે સપ્ટેમ્બરના મધ્યમાં કોરોનાના કેસ ઓછા થયા ત્યારે પણ કેન સરાગે અહિત સ્વાર્ય કે સપ્ટેમ્બરના મધ્યમાં કોરોનાના કેસ એકાંગ થયા ત્યારે પણ કેન સરાગે કરે જિલ્લા સ્તર સુપી કોરોનાના કેસ પર નજર રાખી હતી અને રાજ્યોને કોરોના માટે કોઈપણ ઈમર્જની સ્થિતોનો સામનો કરવા માટે અને કોરોના સામે હતા માટે અને કોરોના સામે હતા માટે અને કોરોના સામે હતા માટે સ્વર્ધ કરાના માટે તોણે હાથ પરેલા કમાટે તોણે હાથ પરેલા કમાટે તોણે આ પ્લેટની મંગળવારે હતા માટે તોણે ત્યારે તમારી તેણે હાથ પરેલા કમાટે તોણે આ પ્લેટની મંગળવારે હતા માટે તોણે તમારે તમારે તેણે કાથ પરેલા કમાટે તોણે આ પ્લેટની મંગળવારે હતા માટે તોણે તમારે તમારે તમારે તમારે તમારે તમારે તમારે મામે મામિલીની આપી હતી. મંગળવારે હતા માટે તમારે તમારે તમારે તમારે હતા માટે તમારે કાથ કરવા માટે તાણે હતા માટે તમારે હતા માટે સ્તિમારે હતા માટે સ્તિમેને ક્યારે માટે તમારે હતા માટે તમારે હતા માટે તમારે હતા માટે તમારે હતા માટે સ્તિમે હતા માટે તમારે હતા માટે સ્તિમે હતા માટે તમારે હતા માટે તમારે હતા માટે તમારે હતા માટે સ્તિમે હતા માટે તમારે હતા માટે સ્તિમે હતા માટે હતા માટે સ્તિમે હતા માટે સ્તિમે હતા માટે હતા માટે હતા માટે હતા માટે હતા માટે સ્તિમે હતા માટે સ્તિમે હતા માટે હતા માટ કામોની માહિતી આપી હતી. મંગળવારે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય

કેપ્ટને હાઈકોર્ટના આદેશ પછી શં થઈ શકે તેની ચર્ચા કરવા મંગળવારે કેબિનેટની બેઠક બોલાવી હતી. બેઠકમાં સિંહે કેટલાક મંત્રીઓ જાહેરમાં

સરકાર સામે બોલે છે એવું કહીને ચીમકી આપી કે, જે મંત્રીઓને મારામાં વિશ્વાસ ના હોય એ સરકાર છોડી શકે

છે. સિંહની આ કોમેન્ટથી હોબાળો થઈ

રેવાના ગામમાં બેઠકમાં જ જામી પડી. ઉગ્ર બોલાચાલી પછી જાખર અને રંધાવા બંને રાજીનામાં આપીને નિકળી ગયા.

હાઈકોર્ટ્ જજો માટે ફાઈવ

હાઇકોર્ટ જજો માટે ફાઇવ સ્ટાર હોટલમાં ૧૦૦ રૂમ અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીની ફાઈવ સ્ટાર અશોક હોટલમાં ૧૦૦ રૂમ બુક કરાવવાનો આદેશ બહાર પાડતો જોરદાર વિવાદ થઈ ગયો છે. અશોક હોટલ ભારત સરકારની માલિકીની હોટલ છે. કેજરીવાલ સરકારે હાઇકોર્ટના જજ તથા ચાક તેમજ તેમાં ચાક તેમજ

હાલ્લ છે. કજરાવાલ સરકાર હાઇકારમાં જજ તથા સ્ટાક તેમજ તેમના પરિવારજનો માટે આ બુક રૂમ કરાવ્યા છે. જજ, સ્ટાક કે તેમના પરિવારજનો કોરોનાથી બચવા આ રૂમોમાં રહી શકશે. આ સિવાય કોઈને કોરોના થઈ જાય ને

આ સિવાય કાઇન કારાના થઇ જાય ન આઈસોલેશનમાં રહેવાની જીરૂ પડે તો પણ આ રૂમનો ઉપયોગ કરી શકશે. કેજરીવાલ સરકારે રવિવારે ગુપચુપ આ આદેશ બહાર પાડી દીધો હતાં પણ મીડિયાના હાથમાં આ આદેશની નકલ આવી જતાં હોહા થઇ ગઈ. આદેશમાં

રૂમનું ભાડું કોણા ભરશે તે સ્પષ્ટ નથી કરાયું પણ કેજરીવાલ સરકાર પર જ બોજ

ક્રમાં ક/સંમાનિ/અમદ/૯૬/૨૦૨૧

કચેરીનું સરનામું, ટેલીકોન નંબર

કામનં નામ

. જાખડે કેપ્ટનને નિશાન બનાવીને જાખડે કેપ્ટનને નિશાન બનાવીને કહી દીધું કે, કોટકપુરા કેસમાં સીટની તપાસ છતાં બાદલ નિર્દોય છૂટી ગયા એ સરકારની નિષ્ફળતા છે તેથી મંત્રીઓ બોલે તેમાં કશું ખોટું નથી. રંધાવાએ સિંહની વાતને ટેકો આપતાં

બેઠક યોજી દેશમાં હાલ ઉપલબ્ધ હેલ્થ ઈન્ક્રાસ્ટક્ચરની સમિક્ષા કરી હતી બેઠકમાં વડાપ્રધાને અધિકારીઓને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપથી અપગ્રેડ કરવા માટે નિર્દેશો આપ્યા હતા. બેઠકમાં ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતા અંગે પણ ચર્ચા થઈ હતી. ધોળા દિવસે

્પહેલા પાનાનું ચાલુ) બોક્સિજન પ્લાંટસંચાલકો હાજર ન રહ્યા હોક્સિજન પ્લાંટસંચાલકો હાજર ન રહ્યા હોય તેવા પ્લાંટસંચાલકો હાજર ન સ્થા માટે રાજ્ય સરકારને આ આદેશ આપ્યો છે. દિલ્હી સરકાર હાલ ઓક્સિજન સપ્લાય માટે ૧૮ ક્રાયોજેનિક ટેંકર્સને થાઇલેન્ડ્થી મગાવશે. જ્યારે ૨૧ રેડી ટૂ યૂઝ ઓક્સિજન પ્લાન્ટ્સને ફ્રાંસથી મગાવવા જઇ રહી છે

અમરિન્દરસિંહની હાલત કફોડી થઈ ગઈ છે. નવજોત સિધ્યુએ તો કેપ્ટન સામે મોરચો ખોલ્યો જ છે. હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સુનિલ જાખર અને સહકાર મંત્રી સુખર્જિદર રંધાવા પણ સામે પડ્યા છે ને રાજીનામાં ધરી દીધાં હૈ

કેજરીવાલ સરકાર ચમચાગીરી કરવા માટે આ પગલું ભરી રહી હોવાના આક્ષેપો શરૂ થઈ ગયા છે. કેટલાક ડોક્ટરે આ આદેશને ભેદભાવપૂર્ણ ગણાવીને તેને ગા ગાહસાય પાઠળાવ યૂકા પક્કાપાય તમ હાઈકોર્ટમાં જ પડકારવાની જાહેરાત પણ કરી નાંખી છે. ***

વર્તમાન કોરોના કટોકટી : કેન્દ્ર અને રાજકીય પક્ષો દોષિત દેશના ગરીબ અને તવંગર લોકોના

માથે હાલમાં જે રીતે વિનાશ અને કરૂણતા ધૂમી રહ્યા છે તે અપૂર્વ છે . આ પરિસ્થિતિ માટે તૈયાર થવા કેન્દ્ર અને રાજ્યો પાસે ત્રોટ તાવાર પવા કે જૂ અને રાજ્યા વાસ એક વર્ષથી વધુ સમયગાળો હતો, છતાં અત્યારે બંને પક્ષો રોગને રોકવા તથા એની સારવારના મુદ્દે- ઉધારિયા જેવી ત્યા સારવારમાં નુક- ઉપારિયા જેવા સ્થિતિમાં છે. પાટનગરની પરસાળોમાં પૂછાઇ રહેલો પ્રશ્ન એ છે કે જો મતદારોએ મોદી અને એમના પક્ષને સિધ્ધિઓ બદલ મત આપ્યા હોય તો શું કેન્દ્ર વર્તમાન કટોકટી માટે દોષનો અપ્રમાણસરનો હિસ્સો એના માથે લેશે નહિ? અને આના શું રાજકીય પડઘા પડશે નહિ? કેન્દ્ર અને રાજ્યો બંનેએ એમના મનને કન્દ્ર અને રાજ્યા બનેએ અમના મનન એક વર્ષમાં લોકડાઉન તરફથી રોજગારી તરફ વાળી લીધું છે. ભારતે ગયા વર્ષે વિશ્વમાં સહુથી વધુ કડક લોકડાઉનમાં એક ગણાય એવું લોકડાઉન અમલી બનાવ્યું હતું. છતાં કોરોનાનો ચેપ અત્યારે છે એના કન્દ્રત એક નાના અંશ અત્યારે છે એના કન્દ્રત એક નાના અંશ અત્યાર છે અના ફક્ત એક નાના અંશ જેટલો હતો. મોદીએ ૨૦ એપ્રિલે કરેલા રાષ્ટ્રજી ગર્સબોધનમાં લોકડાઉનને છેલ્લા ઉપાયરૂપ હથિયાર ગલાવ્યું. હકીકતમાં હવે જે કોઇ લોકડાઉનને અમલી બનાવાશે તો એ રાજ્યો દ્વારા હશે, તેમજ ૧૮ થી ૪૫ વર્ષના પ્રત્યેક ભારતીયને મકાનારી રસીના કાર્યક્રમમ થનારી ભૂલચૂકો પણ રાજ્યોના માથે ઢોળી દેવાશે.

રસી માટેના કાચા માલ પરના નિયંત્રણો હળવા કરવા વિનંતી

ભારતે દેશભરમાં કોરોનાની ફેલાયેલી અપૂર્વ વિનાશ-લીલા વચ્ચે અમેરિકાને વૈશ્વિક રસી પુરવઠા પરના અંકુશોને હળવા કરવા વિનેતી કરી છે. વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના ત્વવકારિક ઇન્ટરિયાન ફાઇન્ડિસર્જા નિયામક અરવિંદ ગુપ્તા, કાર્નેજી ઇન્ડિયાના નિયામક રૂદ્રા ચૌધરી તથા ઓબ્ઝર્વર્રસિર્ચફાઇન્ડેશનના સ્ટ્રેટેજિક સ્ટડીઝ પ્રોગ્રામના વડા હર્ય પંતે પ્રમુખ જો બાઇડેનના વહીવટીતંત્રને ડિફેન્સ પ્રોડકશન એક્ટર્ (ડીપીએ), ૧૯૫૦માં અપવાદ રાખીને, અમેરિકા, કોરોના રસીના ઉત્પાદન માટે જરૂરી કાચી સામગ્રીની નિકાસ પરના નિયંત્રણોને હળવા કરે એવી વિનતી કરી છે.

અમદાવાદ જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ એના વાર્ડન જાહેર વિભાગ એના વાર્ડન જાહેર વિભાગ એના વાર્ડન જાહેર વિભાગ કર્યાં હતા છે. તે પારંગ તે હતા કરવાલ અમદાવાદ કરવાલ અમદાવાદ કરવાલ અમદાવાદ કરતાલ અમદાવાદ કરતાલ અમદાવાદ કરતાલ અમદાવાદ જાહેર તે અભ્યાસ અમદાવાદ જાહાવા અભ્યાસ જાહાવાના અભ્યાસ જાહેરા માના અમદાવાદ જાહાવાના કરીના કરતાને અમદાવાદ જાહાવાના કરતાલ અમદાવાદ જાહાવાદ અમદાવાદ અમદાદ અમદાવાદ અમદાદ અમદાદ

નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

ઓનલાઇન ટેન્ડર નિવિદા નં. ૦૧ સને. ૨૦૨૧-૨૨ સા.જ.કૉ. મુખ્ય નહેરોને લગતા જુદા જુદા ૧૦ (દક્ષ) કામો.

રા. ૧૨૯.૧૧ લાખના કુલ તા. ૧૦/૦૫/૨૦૨૧ સમય : ૧૮.૦૦ કલાક સુધી . ટેલીશેન કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, યરોર્ડ નહેર વિભાગ નં-3. વિસનગર. શેન નંબર (૦૨૭૬૫) ૨૩૧૦૨૪ (<u>www.nprocure.com</u> નો સંપર્ક કરવો.

- ઇન્દર સાહની

AXIS BANK LTD.

Regd. Office: 'Trishul', 3rd floor, Opp. Samartheshwar Temple, Near Law Garden, Ellisbridge, Ahmedabad - 380 006. CIN: L65110GJ1993PLC020789, Phone: 079-26409322, Fax: 079-26409321, Email: shareholders@axisbank.com

AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31st MARCH, 2021

(Circlads)

	А	xis Bank (Standaloni	e)	Axis Bank (Consolidated)			
PARTICULARS	FOR THE QUARTER ENDED 31.03.2021	FOR THE YEAR ENDED 31.03.2021	FOR THE QUARTER ENDED 31.03.2020	FOR THE YEAR ENDED 31.03.2020	FOR THE QUARTER ENDED 31,03,2021	FOR THE YEAR ENDED 31.03.2021	FOR THE QUARTER ENDED 31.03.2020	FOR THE YEAR ENDED 31.03.2020
Total income from operations	20,213,46	78.483.49	20,219,57	78,171,72	21,028,45	80,847,94	20,786.23	80,057,67
Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary forms)	3,509,67	8,905,84	(1,878,91)	4,904,23	3,957,20	9,750,08	(1,767,58)	5,280,0
Not Proft / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	3.989.67	8.905.84	(1.878.91)	4.904.23	3.957.20	9.750.08	/1.757.58	5 280 0
Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	2,677,06	8,588,50	(1,387,78)	1,527,22	2,960,40	7,195,50	(1,262,43)	1,853,1
Paid-up equity share capital (Face value #25- per share)	612,75	612.75	584,34	564,34	612,76	612,75	564,34	564,3
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	100,990,28 (As on 01* March, 2021)	100,990,25 (As on 31° March, 2021)	84,383,51 (As on 31* March, 2020)	84,383,51 (As on 31* March, 2020)	1,02,980,95 (As on 31* March, 2021)	1.02,980,95 (As on 31* March, 2021)	85,776.09 (As on 01* March, 2020)	85,778,0 (As on 31 March, 2600
Earnings per Share (Face value †2)- per share) (for continuing and discontinued operations) (†) (not annualised) - Basic	8.74	22.15	14.92)	5.99	9.50	24 19	(4.42)	8.5
- Diluted	8.72	22.00	14,92)	5.97	9.58	24.13	14.481	6.8

- Information relating to Total Comprehensive Income and Other Comprehensive Income is not turnished as Ind AS is not yet made applicable to banks
- The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchange under The address is an institution of the Statish (Children of Administration of the Statish (Statish of Statish of

Place: Mumbai Date: 27th April, 2021

સ્થળ : મહેસાણા તારીખ : ૨૨-૦૪-૨૦૨૧

AMITABH CHAUDHRY MD & CEO

વોક ઈન ઈન્ટર્વ્ય

લાયકાત એમ.ડી. ફિલ્મ્સીયન એમ.ડી., એનેસ્પેસીયા એમ.ડી. માઇકોજાયો લોલ્પ્સ્ટ મે.ડીકલ પ્રકિલ્સીલ ઓક ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત MBBS ઉમેદ્વાર

पश्चिम रेलवे – अमहावाद डिविजन <u>વિવિધ એન્જિનિયરીંગ કાર્યો</u> -ેટ-ગર નોકીસ નો છા, વર્ષ 2021-22. તા. 23.04.2021

ડિઆરએમ એડિઆઈ ફિલ્દી. સેમાન એ જીવાર (વી.વે) પ્રાંગલ 1 નવ 70,71,243,32 01-2021-22 અફિલ્ડાએક સેઝ 582,17 થી 599,42 7.24 કિ.મી.) સુધી સદલન જાદપીપાડી કેરેલન વચ્ચે વિશ્વના ધન્સામાં ભાવતી હાઇન ની નથી શરૂ દેશ યુ

2,61,18,186.42

36,89,550.01

18,30,876.40

સે ડુનિફસ રાઈય II ક્વૉટર્સનુ બાપપ્રમ

્રાના વર્ષ પાટ) ડીનાવચેમ-મંત્રીએલર્ડ-65-2021-22 ડિનાવચેમ-મંત્રીએલર્ડ-ડિનાવચેમ-મંત્રીએલર્ડ-ડિનાવચેમ-સ્ટોઇન્ડિયાન એન્યુઓપર સાંત્રાસભ્ય અધિકારોય મંત્રીએલર્પ કોર્યુલ, સંગ્રહ્મ, અગ્રયાયએક, સુસી, મુખ્યુર, તેંજનાં, 10 પક્ષેને સંદે દેશ દ. (મિલ્મેલ્સ)

તલુર્દિ (મે વર્ષ માટે) 26 કીમારમેમ મેદીઆઈ 2021-22 ના વર્ષ મહે દિવસના એન્જનીવર 06-2021-22 (પશ્ચિમ) અંચદગાદના અદિવાસેય મેડલ DG

| 2007.22 | Volume 1 - Volume 1 - Volume 2 - Volume 1 - Volume 2 - Volume 2

અમારાતાઃ - 382345. ઈ-રે-કરમાં ભાગ લેવા માટેલેલ્લાઈકઃ <u>worm.lnaps.gov.ln</u> <u>Ar.os</u> આપો માહિક કરો: ૄ flacebook.com/WesternRiy• આપો કોલોક કરો કે witter.com/WesternRiy



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ સેક્રેટરી ઓફીસ **નોટિસ** લમાં શહેરમાં કોરોના વાઇરસને કારણે ઉદભવેલી અતિગંભીર પરિસ્થિતિને ધ્યાને

લઈ આગામી શુક્રવાર તા. ૩૦–૦૪–૨૦૨૧ના રોજ સવારે ૧૧–૦૦ વાગે સ્ટે.ક. રૂમ, સરદાર પટેલ ભવના, દાશાપીઠ ખાતેથી વિડીયો ફોન્કરન્સના માયમાયો ઓનલાઈન પ્રવાર સાસાન્ય માસિક સભા મોઢુક રાખવામાં આવેલ છે. તા. ૨૭–૦૪–૨૦૨૧ સતી: ૨૦૬૦ ક્ષારે છે. માસે ક્ષારે મ્યૂક્ય

હા :- અરૂણ આર. પડથા મ્યુનિસિપલ સેકેટરી

भ्युनिक्षिण्य सेडेटरी

Gujarat Council of School Education
State Project Office, Samagra Shiksha
Sector - 17, Gandhinagar (Gujarat)

Samagra Shiksha, Gujarat Council of School Education is hereby
inviting agencies for "Selection of Project Management
Consultancy (PMC) to ensure the implementation and monitoring
of activities unfer Gujarat Outcomes for Accelerate Learning
(GOAL) School Education Excellence Program (SEEP)". Scheduld of HPF is a sunder:

ule of RFP is as under : Date of publishing of RFP Last Date of Bid Submission or more information, kindly visit www.nprocure.com State Project Director

State Project Office, Samagra Shiksha Sector-17, Gandhinagar (Gujarat)

INF/111/21-22

University Health Centre The Maharaja Sayajirao University of Baroda Opp Rosary School, Pratapgunj Vadodara -390 002. Gujarat, India. Tel. (+91 0265) 2791616

NOTIFICATION NO.UHC/243

NOTIFICATION NO. UHC/243
Traders are invited on ARC (Annual Rate contract) bases from approved icenses drug manufacturers, suppliers, distributors, agencies for purhase of quality Medicines. 8 Medical consumables for the patients of The University Health Centre for the period of 15166/2021 to 1406/2023 and who can office maximum discounts on rates of medicine/medical consumables so per terms & conductors contained in the "Perioder Form." The Tender documents confaring detailed informational terms and conditions can be devinided from the websit https://www.hprocuce.com. The tender will be remain open from 30104/2021 to 1306/2021. Those who download the tender document from website should endose the DD for Rs 1000-(Feeb) 8. The bid security of Rs. 15.000-(EMD) in favour of "The Registrar, Maharaja Sayajiao University of Bandai" payales at Vacodara. The tender documents are not transferable or any circumstances.

Date - (01/2021

પ્રવહન વર્તુળ કચેરી-જેટકો નડિયાદ Medical Officer University Healthcentre

Vadodara.

(Hard Copy)

OSM CIRCLE OFFICE, GOTRI ROAD BARODA-390 021 Tel: 2355520/21 Fax 23:3184 barodaom@gebmail.com E8P Dept-Goo: Pittp://guj-pot gov in CIN U40102GJ2003SGC042907

MADHYA GUJARAT VIJ COMPANY LIMITED

EAP Dept-GoS- http://gup-pdf gev in CIN Land 1982-1984 (Sr. No. 1 to 4 Date extend) (1) Tender ID No. 445551 for Himg of Jeep (Closed Body) 9 Seater, white color and ladder Van White Color, latest Model-2021 for Bando OSM 445551 for Himg of Jeep (Closed Body) 9 Seater, white color and ladder Van White Color, latest Model-2021 for Bando OSM Osmolor (2) Tender ID No. 44555 for Himg of Jeep (Closed Body) 9 Seater, white color and ladder Van White Color, latest Mode-2021 for Boddel OSM division office and Varcous sub division offices under Body) 9 Seater, white color and ladder Van White Color, latest Mode-2021 for Boddel OSM division offices and Varcous sub division offices and Varcous sub division offices and Various sub division offices under Dahol OSM Division (6) Tender (Do No. 44556) to Himg of Jeep (Closed Body) 9 Seater, white color and ladder Van White Color, batest Model 2021 for Jamburs OSM division offices under Dahol OSM Division (6) Tender Robte (Closed Body) 19 Seater, white color and ladder Van White Color, batest Model 2021 for Jamburs OSM division offices and Var out on the Color of Particle (10 No. 44556) to Himgo of Jeep (Closed Body) 9 Seater, white color and ladder Van White Color, batest Model 2021 for Jamburs OSM division offices under Dahol OSM Division (6) Tender Robte (10 No. 4556) to Himgo of Leep (Closed Body) 9 Seater, white color and Ladder Color (10 No. 4556) to Himgo of Seater (10 No. 4556) to Himgo of Color (10 No. 4556) to Himgo of Leep (10 No. 4556) to Himgo of L

S E (O&M) Baroda

AHMEDABAD MUNICIPAL CORPORATION Water Operation (Elect. & Mech.) Department E-Tender Notice

Tender for O & M with comprehensive repairing, maintenance of all Electrical and Mechnical equipment and cleaning works of Water Pumping Station with labor and material upto 31.07.2023 of 08 Nos. Water Pumping Station sof South Zone of AMC.

Tender for Comprehensive repairing, servicing and mainenance of Chlorination system with connection, disconnection and transportation of chlorine cylinder up to 31.07.2023 for 08 Nos. Water Distribution Stations of SOUTH ZONE of AMC.

Augmentation & SITC of Pumping Machinery with related Mechanical, Electrical and Instrumentation work with five years of Operation & Comprehensive Maintenance for Dhor Bajar WDS of South Zone of AMD.

Last Date of Online Tender Submission	Date :- 26/05/2021 up to 18.00 Hrs
Last Date of Tender Submission (Hard Copy)	Date :- 27/05/2021 up to 16.00 Hrs
Date of Tender Opening	Date :- 27/05/2021 up to 17.00 Hrs
Details and Tender Available on:-	"www.amc.nprocure.com"



Gujarat Energy Transmission Corporation Limited, Transmission Circle Office, P.O. Dabhan, Nadiad Dt. Kheda, Gujarat, Pin- 387 320.

Tel No. (0268) 2581816 :Fax No. (0268) 2581935, Corporate Identity No. U40100GJ1999SGC036018 Email: nadiadtr@gebmail.com/ setrnadiad.getco@gebmail.com

જાહેર સુચના જેટલે-નાડિયાદ વર્તળ કરો રહેલા ... , જ અને ૫ મે ૨૦૨૧ના રોજ એમે-ટીસ લાઇન્મેનની પોજાવનાર ભરતી પ્રક્રિયાદ વર્તળ કચેરી કેઠળ તા . , જ અને ૫ મે ૨૦૨૧ના રોજ એમે-ટીસ લાઇન્મેનની પોજાવનાર ભરતી પ્રક્રિયા સ્થળ પોલ સ્ટેટ માટે સંબંધિત ઇમેદવારોને વર્તાળ કરો હતા કરો છે. કેટલા કેઠ લાઇ જે હતામાં કોરોના વાયરસને લગતી પરિસ્થિતિને પ્યાનમાં રાખીને હાલ પુરતી મોફ્ફ રાખલામાં આવેલ છે. લાગતા વળગતા ઇમેદવારોએ આ અંગેની નોંધ લેવા પિનેલી છે.

વિર્નેતી છે. પોલ ટેસ્ટ માટેની હવે પછીની તારીખ નક્કી થયે અલગથી જાણ કરવામાં આવશે. (શ્રી આર.કે. પટેલ) અધિશક ઈજનેર (પ્રવહન)

જાહેર નિવિદા નં. ૧૬ ત્રીજો પ્રયત્ન

જુદરાત રાજ્યના નામદાર રાજ્યવાલશી વર્તી હૈ.પી.જાંઈ.યું. અને કાર્યવાલક ઇંજુનેર, પંચાયન માં, અને મ. વિભાગ, ગોધોનગર, જિલ્લો: ગોધોનગર કોન નં. (૦૦૯) રેગ્રેડ પાજલ્ટ હ્યાર પ્રામાનમાં ગ્રામ લાક પોજના કે એક્સ્ટર્ન પેટ લેટલ કોન નં. (૦૦૯) રેગ્રેડ પાજલ્ટ હ્યાર પ્રામાનમાં ગ્રામ લાક પોજના કે એક્સ્ટર કાર્યા હોયના ને પાયલ હોય કાર કોન કોન કોન અને પારનો કોનો નો માપેલ બાવા તેની સમક્ષ લેશીમાં ને પોયલ આવતા તેની સમક્ષ લેશીમાં ને પોયલ આવતા તેની સમક્ષ લેશીમાં ને પોયલ અભ્યાત તેની સમક્ષ લેશીમાં ને પોયલ અભ્યાત તેની સમક્ષ લેશીમાં ને પોયલ અભ્યાત તેની સમક્ષ લેશીમાં ને પોયલ કે તેના લેટલ લેટલ હોયોના ને પોયલ સમક્ષ પાસે છે. ઓનલાઈન દાઈનલોડમાં તે તેના તેના તેના તેના સમક્ષ લેશીમાં ને પોયલ સમક્ષ પાસે લેટલ હોયોના ને પોયલ સમક્ષ પાસે હોયોના ને પોયલ સમક્ષ પાસે હોયોના ને પોયલ સમક્ષ પાસે હોયોના સમક્ષ પાસે હોયો સમક્ષ પાસે હોયો સમક્ષ પાસે હોયો સમક્ષ પાસે હોયા સમક્ષ પાસે હોય

ા ટેન્ડર જોવાની તારી			22.08.2029
			૦૫,૦૫,૨૦૨૧
ા.ઇ.શ્રી પંચાયત મા.	ન્ય દસ્તાવેજો ફક્ત આર.પી.એડી.થી રજુ કરવાની મ. વર્તુળ, ગાંધીનગરની કચેરીએ, પાટનગર યોજન	ા ભવન,સે.૧૬ ગાંધીનગર	13,04,2021
ટેંગિની તારીખ			08/04/202 1
નીડ ખોલવાની તારીખ	l .		१०,०५,२०२१
પૈકેજ નં.	કામનું નામ	અંદાજીત રકમ રૂાં. લાખમાં	ટેન્ડર ફ્રી
જજે ૦૯૦૫ પીડ	એસ.એચ૧૩૦-ફતેહપુર-સોલૈયા-સમી હરણાહોડા – એમડીઆર-૧૨	90,98Y	₹000,00
	ા સબમીશનની તારી બાનાની રકમ તથા અ ા. ઇ. શ્રી પંચાયત મા. ટીંગની તારીખ નીંડ ખોલવાની તારીખ પૈકેજ નેં. જજે ૦૯૦૫	ર સંપ્યાધાનની તારીએ અને સમય મામાનાની રસ્ત્ર માં આ મહત્વારે છે હતા આર. પી. એટી, પી. રજૂ કરવાની ૧. ડે. શી પંચાયત મા.સ. વર્તુંગ, સોપીનગરની કચેરીએ, પાટનગર યોજન ટીડાની તારીય પી.ક પોલવાની તારીય પૈકેજ ને. ક્રામનું નામ જઈ ૮૯૮પ એસ.એવ.ન ૩૦-સ્તેહપુર-સોલિયાનમાં	વાસપોમાનની તારીખ અને સમય માનવાની રામ વાસ પ્રકાશોજે કહત આર.પી. સે.ટી. થી વધુ કરવાની . ડે. શ્રી પોધાલ મા.મ. વર્તુંળ, ગોપોનાવરની કરેવીએ, પાટનવર વોજના ભવન, સે. ૧૯ ગોપીનગર ટીટનો તારીખ શ્રીદ્રખોત નારીખ પૈકેજ ને ક્રમનું નામ એક્સાલ તારીખ પૈકેજ ન ક્રમનું નામ એક્સાલ સ્ટાન્ડ સ્ટા